

# S.D. Arts and B.R.shah Commerce College, Mansa

U.G.B.A. SEM-1 Subject: Foundation : ( Indian Epic Tradition //Ramayan )

## Question Bank

- (1) વાલ્મીકિ કૃત રામાયણમાં કેટલા શ્લોકો આવેલા છે ?  
(a) 25000 (b) 24000 (c) 27000
- (2) વાલ્મીકિ કૃત રામાયણમાં કેટલા સર્ગો આવેલા છે ?  
(a) 500 (b) 550 (c) 551
- (3) વાલ્મીકિ રચિત રામાયણ કેટલા કાંડ ધરાવે છે ?  
(a) છ (b) સાત (c) આઠ
- (4) બાલકાંડની કથા અનુસાર સૌપ્રથમ કોણ વાલ્મીકિને રામાયણની કથા ટૂંકમાં કહે છે ?  
(a) બ્રહ્માજી (b) વિષ્ણુજી (c) નારદજી
- (5) કોના આશીર્વાદ મેળવ્યા પછી વાલ્મીકિએ રામાયણની રચના કરી ?  
(a) નારદજીના (b) બ્રહ્માજીના (c) વિષ્ણુજીના
- (6) મહર્ષિ વાલ્મીકિ કેવા કવિ છે ?  
(a) આદિ કવિ (b) પ્રાચીન કવિ (c) અર્વાચીન કવિ
- (7) સ્વરૂપની દ્રષ્ટિએ રામાયણ કેવું કાવ્ય છે ?  
(a) મહાકાવ્ય (b) કાવ્ય (c) નાટ્ય
- (8) અયોધ્યામાં કયા રાજાનું શાસન હતું ?  
(a) દિલીપ (b) દશરથ (c) ભરત
- (9) રામની માતાનું નામ શું હતું ?  
(a) કૈકેયી (b) કૌશલ્યા (c) સુમિત્રા
- (10) ઋષિ વિશ્વામિત્ર રામ-લક્ષ્મણને લઈને ક્યાં પહોચ્યા ?  
(a) લંકા (b) મિથિલા (c) મથુરા
- (11) રાવણ કોનો દેશનિકાલ કરે છે ?  
(a) કુંભકર્ણ (b) ઇન્દ્રજીત (c) વિભીષણ
- (12) રામ અને લક્ષ્મણને બ્રહ્માસ્ત્રથી કોણ મુર્છિત કરે છે ?  
(a) કુંભકર્ણ (b) ઇન્દ્રજીત (c) રાવણ
- (13) રાવણ લંકામાં સીતાને ક્યાં કેદ કરે છે ?

- (a) અશોક વાટિકા (b) નૃત્ય વાટિકા (c) કલા મંડપ
- (14) રાવણની બહેનનું નામ \_\_\_\_\_ હતું.
- (a) મંદોદરી (b) શૂર્પણખા (c) લંકાદેવી
- (15) રામાયણ એ \_\_\_\_\_ પ્રેમનું કાવ્ય છે.
- (a) રાષ્ટ્ર (b) સમાજ (c) કુટુંબ
- (16) \_\_\_\_\_ ને કારણે દશરથ વિશ્વામિત્ર સાથે રામને મોકલતા સંકોચ અનુભવે છે.
- (a) પુત્ર સ્નેહ (b) દેશપ્રેમ (c) પત્ની પ્રેમ
- (17) કોના વિયોગમાં રાજા દશરથ તડપી- તડપીને મોતને ભેટે છે ?
- (a) ભરતના (b) કૈકયીના (c) રામના
- (18) મહાકવિ તુલસીદાસનો જન્મ વિક્રમ સંવત \_\_\_\_\_ મા થયો હતો.
- (a) વિ. સં. 1560 (b) વિ. સં. 1554 (c) વિ. સં. 1583
- (19) તુલસીદાસનું આરંભિક નામ \_\_\_\_\_ હતું.
- (a) રામબોલા (b) કૃષ્ણ (c) સુદામા
- (20) મહાકવિ તુલસીદાસના ગુરુનું નામ શું હતું ?
- (a) વિશ્વામિત્ર (b) ભરતમુનિ (c) નરસિંહદાસ
- (21) કવિ તુલસીદાસના લગ્ન કોની સાથે થયા હતા ?
- (a) મંદાકિની (b) રત્નાવલી (c) રંભા
- (22) તુલસીકૃત રામચરિત માનસની રચના ક્યારે થઈ હતી ?
- (a) સંવત 1631 (b) સંવત 1635 (c) સંવત 1651
- (23) મહાકવિ તુલસીદાસ રચિત ગ્રંથો કેટલા છે?
- (a) 17 (b) 12 (c) 37
- (24) પાર્વતી મંગલ ગ્રંથમાં કોના વિવાહનું વર્ણન છે?
- (a) રામ વિવાહ (b) શિવ પાર્વતી (c) કૃષ્ણ ઋકમણી
- (25) જાનકી મંગલમાં \_\_\_\_\_ નું વર્ણન છે.
- (a) વિષ્ણુ લક્ષ્મી (b) શિવ પાર્વતી (c) રામવિવાહ
- (26) લક્ષ્મણ \_\_\_\_\_ અવતાર મનાય છે.
- (a) બ્રહ્માનો (b) શેષનાગનો (c) વિષ્ણુનો
- (27) વાલ્મિકીનું મૂળ નામ \_\_\_\_\_ છે.
- (a) તુલસીદાસ (b) રત્નાકર (c) વિશ્વામિત્ર
- (28) રામસેતુ બનાવવા કોણ મદદ કરે છે?
- (a) નલ અને નીલ (b) વિભીષણ (c) જટાયું
- (29) રામચરિત માનસની ભાષા \_\_\_\_\_ છે.

(a) બંગાળી (b) પંજાબી (c) અવધિ

(30) \_\_\_\_\_ વીરજીવી પાત્ર છે.

(a) લક્ષ્મણ (b) હનુમાન (c) સુગ્રીવ

(31) સીતા-હરણ વખતે \_\_\_\_\_ એ રાવણ સામે યુદ્ધ કર્યું હતું?

(a) લક્ષ્મણ (b) જટાયું (c) અંગદ

(32) હનુમાનજી અશોકવાટિકામાં કોનો વધ કરે છે?

(a) અક્ષયકુમાર (b) ઇન્દ્રજીત (c) કુંભકર્ણ

(33) ઉત્તર ભારતમાં રામચરિતમાનસ જેટલુંજ ગૌરવ \_\_\_\_\_ માં ક્રમ્બ રામાયણને મળ્યું છે.

(a) મધ્યપ્રદેશ (b) ઓરિસ્સા (c) તમિલનાડુ

(34) રામે વનવાસની પ્રથમ રાત કઈ નદીના કિનારે વિતાવી હતી?

(a) સરયું (b) ગંગા (c) તમસા

(35) રામ \_\_\_\_\_ નદીમાં સમાધિ લે છે.

(a) ગંગા (b) સરયું (c) તમસા

(36) રાવણના ત્રાસથી કંટાળેલી પૃથ્વી કોની પાસે જાય છે?

(a) બ્રહ્મા (b) વિષ્ણુ (c) મહેશ

(37) રામની પાદુકા રાજસિંહાસન પર બિરાજમાન કરી ભરત કયાં નિવાસ કરે છે?

(a) મિથિલામાં (b) ચિત્રકૂટમાં (c) નંદિગ્રામમાં

(38) ભરતના પુત્રનું નામ શું હતું?

(a) તક્ષ (b) અંગદ (c) ચંદ્રકેતુ

(39) રામાયણમાં કુટુંબપ્રથાનો સંસ્કારબંધ કેટલા વર્ષોથી જળવાઈ રહ્યો છે?

(a) 1000 (b) 2500 (c) 1500

(40) રામ કોના આશ્રમમાં લવ-કુશને જોઈ પુત્રો પ્રત્યે આકર્ષાય છે?

(a) વશિષ્ઠ (b) વાલ્મીકિ (c) કૃપાચાર્ય

(41) તુલસીદાસે પોતાના જીવનસંઘર્ષની કરુણ કથા \_\_\_\_\_ ગ્રંથમાં વર્ણવી છે.

(a) વેરાગ્ય-સંદીપની (b) રમલલાન હ છૂ (c) વિનય પત્રિકા

(42) તુલસીદાસની કવિતાવલીમાં કુલ કેટલા છંદ છે?

(a) 325 (b) 315 (c) 320

(43) હનુમાનજીને સાગર પર કઈ રાક્ષસી રોકીને ગળી જવા તત્પર બની હતી?

- (a) મંદના (b) શુરપંખા (c) સુરસા  
(44) બ્રહ્માસ્ત્રના પ્રયોગ દ્વારા હનુમાનજીને પકડી કોણ રાવણ સામે રજૂ કરે છે?  
(a) મેઘનાદ (b) અક્ષયકુમાર (c) માલ્યવાન  
(45) સીતાજીએ હનુમાનજીને પોતાની કઈ નિશાની શ્રીરામને આપવામાટે આપી હતી?  
(a) અંગૂઠી (b) ચૂડામણિ (c) માળા  
(46) શ્રી રામ કેટલા દિવસ સુધી સાગરને માર્ગ આપવા માટે પ્રાર્થના કરે છે?  
(a) બે (b) ત્રણ (c) ચાર  
(47) તુલસીકૃત રામચરિત માનસ દેશના કયા ક્ષેત્રમાં લોકપ્રિય છે?  
(a) ઉત્તરભારત (b) પશ્ચિમભારત (c) દક્ષિણભારત  
(48) 'કમ્બ રામાયણ' કયા સાહિત્યનું રામ કાવ્ય છે?  
(a) હિન્દી (b) મરાઠી (c) તમિલ  
(49) આધ્યાત્મ રામાયણએ \_\_\_\_\_ સદીનો ગ્રંથ છે?  
(a) 14મી (b) 15મી (c) 16મી  
(50) આધ્યાત્મ રામાયણની રચના \_\_\_\_\_ દ્વારા કરાઈ હોવાનું મનાય છે?  
(a) પ્રેમાનંદ (b) ઋષિવશિષ્ઠ (c) રામાનંદ